

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov. - 2018
INDIRECT TAX LAW - 1 (D.S.E -3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-1 પરોક્ષ કર શું છે? જુદા જુદા પ્રકારનાં પરોક્ષ કર જણાવો. (20)
 અથવા
- પ્રશ્ન-1 પરોક્ષ કરવેરાની લાક્ષણિકતાઓ શું છે? પરોક્ષ કર અને પ્રત્યક્ષ કરનો તફાવત જણાવો.
- પ્રશ્ન-2 સેવા કર એટલે શું? સેવાઓનાં સ્પષ્ટ વર્ણનનાં અર્થઘટન માટે સિદ્ધાંતો સમજાવો. (20)
 અથવા
- પ્રશ્ન-2 સેવા કરની લાક્ષણિકતાઓ શું છે? તેની કાયદેસરની જોગવાયો જણાવો.
- પ્રશ્ન-3 સેવા કરની નોંધણીની અરજી કરવા માટે જરૂરી કાર્યાવહી અને દસ્તાવેજો જણાવો. (15)
 અથવા
- પ્રશ્ન-3 'સેનવેટ' (CENVAT) એટલે શું? તેનાં કાર્યો શું છે?
- પ્રશ્ન-4 મુલ્ય આધારિત કર (VAT) એટલે શું? ભારતમાં તેની વિશેષતાઓ શું છે? (15)
 અથવા
- પ્રશ્ન-4 મુલ્ય આધારિત કર (VAT)નો ખ્યાલ સમજાવો અને મુલ્ય આધારિત ગણતરીની પદ્ધતિઓ સમજાવો.

ENGLISH VERSION

- Que-1 What is an Indirect tax? Explain the various types of indirect taxes. (20)
 OR
- Que-1 What are the features of Indirect Tax? Give the difference between Direct tax and indirect tax?
- Que-2 What is Service Tax? Explain the Principles for interpretation of specified descriptions of services. (20)
 OR
- Que-2 What are the Features of Service Tax? Explain the statutory provision of charging service tax.
- Que-3 Explain the Procedure and documents required for Applying for Service Tax Registration. (15)
 OR
- Que-3 What is the meaning of CENVAT? What are their functions?
- Que-4 What is Value Added Tax or VAT? What are the Features of Value Added Tax in India? (15)
 OR
- Que-4 Explain the concept of VAT and Method of computation of VAT.
